

પ્રિય પરિવારો,

યોર્ક રિજન ડિસ્ટ્રિક્ટ સ્કૂલ બોર્ડ કિન્ડરગાર્ટનથી ગ્રેડ 12 સુધીના વિદ્યાર્થીઓને [દરેક વિદ્યાર્થી મહત્વના છે સર્વેક્ષણ](#) માં સામેલ કરશે. સર્વેક્ષણના વહીવટમાં YRDSBને ટેકો આપવા માટે [CCI સંશોધન](#) સાથે કરાર કરવામાં આવ્યો છે. ઓનલાઇન સર્વેક્ષણ 24 એપ્રિલ, 2023 થી 10 મે, 2023 સુધી થશે અને બહુવિધ ભાષાઓમાં ઉપલબ્ધ હશે.

બોર્ડ આંતરિક અને બાહ્ય ભાગીદારોને ડ્રાફ્ટ સર્વેક્ષણો પર તેમનો પ્રતિસાદ આપવા માટે તક પૂરી પાડી હતી. આ પ્રતિસાદનો ઉપયોગ અંતિમ સર્વેક્ષણોના વિકાસની જાણ કરવા માટે કરવામાં આવ્યો હતો. અમે એ દરેક વ્યક્તિનો આભાર માનીએ છીએ કે જેમણે અમને પોતાનો પ્રતિસાદ આપવા માટે સમય આપ્યો. સર્વેક્ષણની અંતિમ આવૃત્તિઓ [બોર્ડની વેબસાઇટ](#) પર ઉપલબ્ધ છે.

કિન્ડરગાર્ટનથી ગ્રેડ 3ના વિદ્યાર્થીઓના પરિવારો માટેની માહિતી

કિન્ડરગાર્ટનથી ગ્રેડ 3 સુધીના વિદ્યાર્થીઓ તેમના માતા-પિતા, વાલી(ઓ) અથવા સંભાળ રાખનાર(ઓ) સાથે ઘરે સર્વેક્ષણ પૂર્ણ કરશે. ગ્રેડ K-3 ના વિદ્યાર્થીઓના પરિવારો કે જેઓ પોતાના બાળક માટે સર્વેક્ષણ ભરવા માંગતા ન હોય તેઓ કાગળ પરના આમંત્રણને અવગણી શકે છે, જેને સર્વેક્ષણથી બહાર રહેવાનું પસંદ કર્યું એમ ગણવામાં આવશે.

કિન્ડરગાર્ટનથી ગ્રેડ 3 સુધીના વિદ્યાર્થીઓના પરિવારો કે જેમને સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે સમાયોજનની જરૂર હોય (દા.ત., મોટા પ્રિન્ટમાં પેપર સર્વેક્ષણ, પેપરની અનુવાદિત નકલો) તેઓએ વિનંતી કરવા માટે 1-866-450-4907 પર ફોન દ્વારા 27 ફેબ્રુઆરી, 2023 અને માર્ચ 10, 2023 દરમિયાન CCI સંશોધનનો સંપર્ક કરવો જરૂરી છે.

ગ્રેડ 4 થી ગ્રેડ 12ના વિદ્યાર્થીઓના પરિવારો માટે માહિતી

ગ્રેડ 4 થી ગ્રેડ 12 ના વિદ્યાર્થીઓને તેમના શિક્ષક તરફથી સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે એક કાગળ પરનું આમંત્રણ પ્રાપ્ત થશે, અને સર્વેક્ષણ પૂર્ણ કરવા માટે વર્ગમાં સમય આપવામાં આવશે. ગ્રેડ 4 થી ગ્રેડ 12 ના વિદ્યાર્થીઓના માતા-પિતા અથવા વાલીઓ કે જેઓ પોતાના બાળકને સર્વેક્ષણ પ્રાપ્ત કરવા દેવા માંગતા નથી તેઓને **27 ફેબ્રુઆરી, 2023 અને માર્ચ 10, 2023** દરમિયાન તેને સર્વેક્ષણથી બહાર રહેવાની તક મળશે. પરિવારો આ ફોર્મ ભરીને <https://cci-survey.com/YRDSB-ESCS-OPT>, અથવા 1-866-450-4907 પર ફોન દ્વારા CCI સંશોધનનો સંપર્ક કરીને સર્વેક્ષણથી બહાર રહેવાનું પસંદ કરી શકે છે.